

Name :- Maheshwari Vipul Arvind Bhai

Roll NO. - 65 sem - 6

COC Roll NO. - 297

Paper Name COC - Banking & Finance
& code :- MAJ - BAF - 101

PRN NO. - ER3030001100559

COC REG. NO. - COC 2025297

Assignment :-

Q-1 RBI की नाण्यकीय नीति यस्तुत शीत
समजावा

Q-2 यशिशुत प्रकीर ना वल्लडो यशो यस्तुत
नोद लजा .

Assignment

1) RBI ની નાણાકીય નીતિ વિસ્તૃત રીતે સમજાવો.

સી=> બેંક નો અર્થ :-

RBI ભારતનું કેન્દ્રિય બેંક છે. જે 1935 માં સ્થાપિત થયું હતું. તેનું મુખ્ય કાર્ય ભારતની આર્થિક સ્થિતિ સુધારવાનું છે જેમાં નાણાકીય નીતિ એક મહત્વપૂર્ણ ભાગ છે. નાણાકીય નીતિ દ્વારા એક મહત્વપૂર્ણ ભાગ છે. નાણાકીય નીતિ દ્વારા RBI આર્થિક વૃદ્ધિ મંદવારી ના નિયંત્રણ, સંરક્ષણ અને નાણાકીય ક્ષેત્રની સ્થિતિ પર અસર કરે છે આ નીતિને RBI ની મોનરરી કમિટી MPC દ્વારા નક્કી કરવામાં આવે છે જે 2016 માં સ્થાપિત છે અને તેમાં 6 સભ્યો હોય છે.

નાણાકીય નીતિ ના પ્રકારો :-

મુખ્ય ત્રણ પ્રકારો:

- વિસ્તારવાદી નાણાકીય નીતિ
- સંકોચવાદી નાણાકીય નીતિ
- સરવ્ય નાણાકીય નીતિ

1) વિસ્તારવાદી નાણાકીય નીતિ.

"પૌસાધવાદી", ત્યાજ ધરાડો, અર્થતંત્ર સલાવો.

ઉદ્દેશ્ય - વડાંન

ઉદ્દેશ્ય - વડાંન

→ આર્થિક વૃદ્ધિ વધારવી, બેરોજગારી ઘટાડવી, મંદી દૂર કરવી.

विश्वविद्यालय

विपुल भट्ट

कक्षा

PAGE NO.:

DATE: / /

साधनों का उपयोग

- Repo rate घटाई
- CRR / SLR घटाई
- रिजर्व Repo घटाई

व्यस्य

- लोन बढ़ाए।
- GDP वृद्धि

मौलिक

→ मौलिक वृद्धि बढ़ाई

उदाहरण (2020)

Covid-19 का रिपोर्ट

4.00% की दर से CRR 3.00% किया - 21-10 तक

दुबई की लिक्विडिटी कम करने के लिए

2. बैंकिंग नीति

"पैसे घटाओ, व्याज बढ़ाओ, मौलिक बढ़ाओ."

उदाहरण

वर्ष

उदाहरण

→ मौलिक नियंत्रण, आर्थिक "आवश्यक" घटाए जायेंगे.

साधनों का

→ रिजर्व बढ़ाओ.

उपयोग

→ CRR / SLR बढ़ाओ

→ रिजर्व रिजर्व बढ़ाओ.

व्यस्य

→ लोन बढ़ाए

→ Credit बढ़ाए - भाग बढ़ाए

→ रिजर्व रिजर्व बढ़ाओ.

संयम

→ वृद्धि धीमी पडी - खाडे.

उदाहरण (2022-23) :- मांडवारी: 7.8% पर
 → रिपो रेट 6.50% बुधी वधार्या 0.00% पर
 ₹ 2 lakh पर - CPI 5.1% नीरो व्याधी.

3. तरथ नाडाकीय नीति.

"सिंतुलन कल्पे - वधारो न धराडपो."

लक्ष्य	वर्णन
उद्देश्य	→ मांडवारी थाने वृद्धि वरथे संतुलन
रिथली	→ ग्यारे अर्थनंत्र रिथर हाय.
माधना	→ रथ्या डांए इंधार नाहे. → लिडियडरी रिथर राथली → 0.00% / 100% ना थयांहीत उपयोग.
असर	→ अर्थनंत्र रिथर वलि थो थाने

उदाहरण :- 2KGS October मां रिथर 2
 6.50% पर रिथर CPI 4.8%, GPP 7%.

नाण्डाकीय नीति ना मुख्य उद्देशा :-

i) मांडवारी नियंत्रण :- RBI ना प्राथमिक उद्देश्य यथा मांडवारी कणवधानां को लक्ष्य 2016 को लक्ष्य 2016 मा नाण्डाकीय नीति इमवर्क नकी धरुं को

ii) आर्थिक वृद्धि :- GDP वृद्धि ना प्रोत्साहन आणवुं, आसा कुरीने नवकी वृद्धि ना अमये.

iii) नाण्डाकीय स्थिरता :- बैंडीना पुंजी पर्याया, नाण्डाकीय क्षेत्र कुं अंजन धरावुं.

iv) बांकागी अण विनिमय दर :- बांकागी वधारली अण रुपया ना मुल्य ना स्थिर राववुं.

नाण्डाकीय नीति ना साधना :-

-> RBI तनी नाण्डाकीय नीति ना अभुल मां मुर्कवा मां प्रथम अण परांदा साधना को कुपयां कुं को साधना द्वारा RBI बांका एसा अण बैंडीनी अणवधानां क्षमता ना नियंत्रित कुं को.

ii) प्रथम साधना :- अण साधना पैसा ना पुष्य डाने अधु अंतर कुं को अण तनी पुसाय अर्थानत्र पर पडे को.

શીર્ષક	વર્ણન	ઉદ્દેશ્ય	અસર	દિદાહર(%)
Repo rate	RBI બેંકો ને ટૂંક ગ્રામ્ય દે તેના પર વાજ દર બેંકો માંથી મુકીને લેવા લે છે.	માંદગારી, નિયંત્રણ અને વ્યાજદર નો નિર્ધારણ	વધારો - લેવા માંથી -> લેવા મર્યાદા ક્રેડિટ વધે વૃદ્ધિ વધે	(2025) 6.50%
આઈએ	RBI બેંકો પાસેથી ગ્રામ્યરિફા નાણા લે છે તેના પર વ્યાજદર	વ્યાજમાંથી પેંસા શીંચી લેવા	બેંકોનો RBI માં પેંસા જમા કરવા.	6.25% (Repo rate) 0.25% આઈએ
CRR	બેંકોમાં તેમની જમા રકમનો 4% RBI માં રોકડ જમા.	બેંકોની ક્રેડિટ વ્યાપવાની જમાના ઘટાડવા - વધારી	વધારો - બેંકો પાસે આઈએ પેંસા - ક્રેડિટ વધારો - ઘટાડો	4.50% (ચિયર)
SIR	બેંકોમાં તેમની જમા રકમનો 3% RBI માં રોકડ જમા.	બેંકોની સિદ્ધિ અને સરકારની ઘટાડવા નો નિયંત્રણ.	બેંકોની સુરક્ષા - તે રોકડો કરવા	18.00%
મરિનલ રેવેન્ડિંગ ફેસલિટી	બેંકો ઘટાડવા માં સુધારે 0.25% RBI પાસેથી ઘટાડવા સુધારે.	સિદ્ધિથી ટૂંકગાળા માં મદદ	બેંકોની સુધારા થાઈ નો રૂપાય.	6.75%

विपुल महेश्वरी

Value

दिनांक 13/08/20

PAGE NO.:

DATE: / /

2. परादेशी साधना व साधना के डिस्टिन्क्शन व विस्तारण के नियंत्रण के बारे में

साधन	वर्ग	उद्देश्य	विधिवत
open market operation	RBI सरकारी बॉन्ड्स जारी करे	व्यवसायिक सिद्धि व धारणा	परीधी - पंसा लिखित डिग्री व धारणा - पंसा
मार्किटल इंटरवेंशन	डिपॉजिट लोन पर गिरफ्तार करे व धारणा	बॉन्ड्स खरीदने व धारणा	विशेष खरीद व धारणा
मोटा सुअरिंग	RBI बॉन्ड्स को खरीदने व धारणा	नीतिगत पाठन व धारणा	दृष्टि क्षेत्र व धारणा
के डिस्टिन्क्शन	RBI खरीदने व धारणा	भूना व धारणा	लक्ष्य व धारणा

3. शून्य महत्त्वना साधना

साधन	वर्ग	उद्देश्य	विधिवत
LAF	रिपो + रिसेस (रिपो नु) खरीदना	खरीदने लिखित (रिपो) खरीदना	
रिपो ऑपरेशन	7.14, 28 day loan	शून्य व धारणा	लिखित डिग्री
VRR	शून्य व धारणा व रिपो	लिखित डिग्री खरीदना	

* મોનેટરી પોલિસી કમિટી (MPC) :-

→ રચના :- ગવર્નર, ડેપ્યુટી ગવર્નર અને 4 નિયુક્તો

→ વ્યક્તિ :- વર્ષમાં 6 વખત, જેમાં નાણાકીય નીતિના રિજીસ્ટ્રેશન પર મતદાન થાય છે.

→ સંદર્ભિત નિર્ણય પ્રક્રિયા :- મારામારી દરેક ફેરફાર રાષ્ટ્રીય અને આધારિત, જેમાં GDP, CPI, IIP વ્યાજવહી કુશળતા આવે છે.

→ સુપર શુદ્ધિ :- 2025 વુધીમાં, MPC ની વ્યક્તિમાં સંદર્ભિત અને વ્યક્તિ અસર પર ઘાટ કરી શકાય છે.

નાણાકીય નીતિની વ્યાખ્યા અસર :-

-> Monetary Policy એ કંઈક વ્યક્તિ દ્વારા અપનાવવામાં આવતી નીતિ છે, જેમાં પૈસાના પુરવઠા, વ્યાજ દર અને ફરિયાદ પ્રવાહને નિયંત્રિત કરીને અર્થતંત્રને પ્રમાણિત કુશળતા આવે છે. તેની અર્થતંત્ર પર ઘાટ મુખ્ય અસર :-

- i) Economic Growth :-
- > Expansionary Policy
- > Contractionary Policy

(ii) કુળાવો નીચી વ્યાજદરથી માંગ વધે છે

→ નીચી વ્યાજદરથી માંગ વધે છે
કેનાથી કુળાવો વધી શકે છે.

→ ઉંચી વ્યાજદરથી માંગ ઘટે છે
જે કુળાવો ને નિયંત્રણ માંડાવે શકે છે.

iii) Unemployment :-

→ વિસ્તરણકારી નીતિથી સ્વભાવે
વધુ રોકાણ કરે છે, જેનાથી નોકરી યા
વધે છે અને એરેકગારી ઘટે છે.

→ સંકોચકારી નીતિથી રોકાણ ઘટે
છે, જે એરેકગારી વધારી શકે છે.

iv) વિનમય દર :-

→ ઉંચી વ્યાજદરથી વિદેશી મૂડી
આકર્ષણ વધે છે, જેનાથી રૂપિયાનો મૂલ્ય ન ઘાય
છે અને

→ નીચી વ્યાજદરથી મૂડી વહીર
વધે છે, જેનાથી રૂપિયાનો મૂલ્ય ન વધે છે.

નાણાકીય નીતિ ની વંપરીઓ પરની અસરો :-

નાણાકીય નીતિ વંપરીઓ ને રિટર્ક, ક્રેમોડી, ફોરેક્સ, બોન્ડ અને ડેરિવેટિવ્સ માર્કેટ માં સીધી - પરોક્ષ રીતે અસર કરે છે. અસરો પરસ્પરલકારી અને સંક્રમણકારી નીતિ પર આધારિત છે :-

અસર નું ક્ષેત્ર	પરસ્પરલકારી નીતિ	સંક્રમણકારી નીતિ
રિટર્ક માર્કેટ	લાંબ મચ્છી → કોર્પોરેટ નફો વધે → બુલ માર્કેટ	લાંબ મોંઘી → ખર્ચ ઘટે → બેર માર્કેટ
ક્રેમોડી	નીચા રેટ → ગોલ્ડમાં શરૂઆત વધે ક્રૂડ મેંબ વધે	કોચા રેટ → ગોલ્ડ ઘટે; ક્રૂડ .
ફોરેક્સ	રૂપિયો નબળો → એક્સપોર્ટ નો ફાયદો	રૂપિયો મજબૂત → ઇમ્પોર્ટમાં નો ફાયદો
બોન્ડ / ડેરિવેટિવ્સ માર્કેટ	બોન્ડ રીન્ડ ઘટે → બોન્ડ કિંમત વધે	રીન્ડ વધે → બોન્ડ કિંમત ઘટે .

નાણાકીય નીતિ ની આચાર અને નિર્દેશકો પરની અસરો :-

Monetary Policy મજબૂત વિનિમય દર વ્યાજદર અને સ્પર્ધાતંત્ર ની

आंगण - विद्युत आपूर्ति - कुरील - आंगण - अर्थ
निर्देश - Exports पर आधारित कुरील - अर्थ

लेनी - अर्थ - विद्युत आपूर्ति (Expansionary)
अर्थ - अर्थ - विद्युत आपूर्ति (Contractionary)

निति - अर्थ - विद्युत आपूर्ति - अर्थ

विद्युत आपूर्ति - अर्थ - विद्युत आपूर्ति - अर्थ

अर्थ - अर्थ - अर्थ

विद्युत आपूर्ति

अर्थ

अर्थ - अर्थ

अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ

अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ

अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ

अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ

अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ

अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ

अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ - अर्थ